



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૮/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૪૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૨૮ કેસ કરી, ૧૨૧ વ્યક્તિઓને ઝડપી, ૮૮૯ લીટર દેશી દારૂ, ૨૪૪ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૦૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૯ કેસ કરી, ૩૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૯૧,૬૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૪૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :

સમાચાર યાદી નં.૧૫૪૨/૧૯

વસ્ત્રાપુર : દિપાશીબહેન વા/ઓ વલયભાઈ પટેલ (ઉ.વ.૨૯)(રહે.સાગર ટેનામેંટ ઇંડીયન ઓયલ પેટ્રોલપંપ પાસે નાના ચિલોડા રોડ) એ તા.૧૧/૮/૨૦૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૫/૨૦૧૮ થી આજદિન સુધીના સમયગાળા દરમિયાન ધ કંટ્રી ક્લબના મેનેજર મહમ્મદ ઉજેફ (ઉ.વ.૩૫)(રહે.બીજો માળ નુરે બુરહાન એપાર્ટમેંટ ખાનપુર) એ દિપાશીબહેન ને ક્લબની મેમ્બરશીપ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ-અલગ બેંક એકાઉન્ટ મારફતે કુલ રૂપિયા ૨,૫૦,૦૦૦/- મેળવી લઈ પરત નહીં આપી દિપાશીબહેન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.ડી.મકવાણા ચલાવે છે.

ઘરફોડ :

સમાચાર યાદી નં.૧૫૪૩/૧૯

કૃષ્ણનગર : નિર્મલકુમાર રાજારામસિંગ સિંગ (ઉ.વ.૩૮)(રહે.શ્યામ હિલ્સ જી.એસ.ટી. કોસીંગની પાસે રાણીપ સાબરમતી) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૮/૧૯ રાતના ૯/૩૦ થી તા.૧૧/૦૮/૨૦૧૯ સવારના ૯/૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આરોપી મિહીર તથા તેના કોઈ ઓળખીતો મિત્ર કૃષ્ણનગર પ્રિયા સિનેમા પાસે આવેલ સ્વર્ણમ બઝાઝ શો રૂમમાં પ્રવેશ કરી, શો-રૂમની અંદર છત ઉપરના ફોલ્સ સીલીંગ જીપ્સમ શીટ કુલ કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- તોડીને ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એમ.ગોહીલ ચલાવે છે.

**આનંદનગર :** રસીકભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.૨૭)(રહે.શીવમ એપાર્ટમેન્ટ ગ્રીન એકર ની સામે ઔડા ના ગાર્ડન પાસે પ્રહલાદનગર) એ અગમ્ય કારણસર તા.૧૦/૦૯/૨૦૧૯ ના કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે એસ.જી.હાઇવે ખાતે આવેલ રાધે રેસ્ટોરન્ટ પાસે તેમની ગાડી માં પોતાની જાતે એસીડ પી લેતા, સારવાર અર્થે તેમને તપન હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૧/૦૯/૨૦૧૯ સાંજના ૫/૪૫ વાગે ફરજ પર ના ડો.શ્રી એ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે આનંદનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મુનીરમહંમદ ઇસુબભાઈ ચલાવે છે.

**નરોડા :** કવન અરવિંદભાઈ પટેલ (ઉ.વ.૧૮)(રહે.આર્શિવાદ એવન્યુ શેલ્બી હોસ્પિટલની સામે હરીદર્શન ચાર રસ્તા નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૧/૦૯/૨૦૧૯ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી જયેન્દ્રસિંહ રૂપસિંહ ચલાવે છે.

**ગોમતીપુર :** જીતેન્દ્રભાઈ રાજુભાઈ ચાવડા (ઉ.વ.૩૦)(રહે.શેઠ કોઠાવાળા વોરાની ચાલી ઝુલતામીનારા રોડ ઉપર ગોમતીપુર) એ આર્થિક તંગીના કારણે તા.૧૧/૦૯/૨૦૧૯ ના કલાક ૧૧/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી અનોપસિંહ કિશોરસિંહ ચલાવે છે.

**વટવા :** બાબુઅલી હમીદશા ફકીર (ઉ.વ.૪૮)(રહે.અહેમદીપાર્ક પ્રેમ કંડકટર ની પાછળ વટવા) એ અગમ્ય કારણસર તા.૧૧/૦૯/૨૦૧૯ ના કલાક ૭/૩૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મહેન્દ્રભાઈ મગનભાઈ ચલાવે છે.

**ઇસનપુર :** પરષોત્તમલાલ માંગીલાલ મારવાડી (ઉ.વ.૪૨)(રહે.કૈલાસનગર સોસાયટી, મહાવીર સ્કુલની પાછળ ઇસનપુર) એ અગમ્ય કારણસર તા.૧૦/૦૯/૨૦૧૯ રાતના ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર અર્થે તેમને એલ.જી.હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૧/૦૯/૧૯ સાંજના ૫/૫૫ વાગે ફરજ પરના ડો.શ્રી એ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ઇસનપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એન.જે.મારૂ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.